https://archive.org/details/bk919/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન
ટ્રસ્ટ રજી.નં.
એ-૩૯૩૧
અમદાવાદ

બંધારણ

સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન

realpatidar.com

https://archive.org/details/bk919/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: {script_name}

https://archive.org/details/bk919/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 11:54:18 +05'30'

realpatidar.com

બંધારણ

સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન

realpatidar.com

https://archive.org/details/bk919/page/n3/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk919/page/n4/mode/1up

સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન ટ્રસ્ટ રજી.નં. એ-૩૯૩૧ અમદાવાદ
realpatidar.com

-: બંધારણ :-

૧. ટ્રસ્ટનું નામ : **'સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન'**

૨. **ટ્રસ્ટનું સરનામું :**

સદર ટ્રસ્ટનું સરનામું અન્ય કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી નીચે પ્રમાણે રહેશે.

"દયા સાગર", ૧૦, અમૃત પાર્ક, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.

૩. **ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર :**

ટ્રસ્ટના કાર્યક્ષેત્રની કોઈ પ્રાદેશિક મર્યાદા કે સીમા રહેશે નહિં.

૪. **ટ્રસ્ટના ઉદ્દેશો તથા હેતુઓ :**

જે ઉદ્દેશો તથા હેતુંઓ બર લાવવા આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

(અ) : **મુખ્ય હેતુંઓ :**

(૧) કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ, લિંગ, સમાજ કે રંગના ભેદભાવ વગર માનવમાત્રના ઉત્થાન માટે શૈક્ષણિક તથા કેળવણી વિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવી તથા ચલાવવી અને આના માટે જરૂરી એવી શાળાઓ, મહાશાળાઓ, શૈક્ષણિક સંકુલો, વ્યવસાયલક્ષી તથા સ્વરોજગારલક્ષી કેળવણી પૂરી પાડતી સંસ્થાઓ સ્થાપવી. ચલાવવી તથા આવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને મદદ કરવી. શિક્ષણ મેળવવાના તમામ સ્તરના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોનું નિર્માણ કરવું તથા તેના નિભાવ માટેની વ્યવસ્થા કરવી. શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષણને લગતી કોઈપણ પ્રવૃત્તિઓ કરવી તથા કરાવવી અને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન તથા મદદ પૂરી પાડવી.

realpatidar.com

https://archive.org/details/bk919/page/n5/mode/1up

realpatidar.com

(૨) કોઈપણ જાતના ભેદભાવ વગર બહોળા સમાજની દરેક વ્યક્તિઓને વૈદકીય, મેડીકલ સારવાર તથા સહાય મળે અને મળતી રહે તે માટે જરૂરી દવાખાના, હોસ્પિટલો, ક્લિનીકો, જાહેર આરોગ્ય કેન્દ્રો, મેડીકલ સંશોધન કેન્દ્રો તથા સંસ્થાઓ, બ્લડ બેન્ક, ચક્ષુ બેન્ક વિ. સ્થાપવા તથા ચલાવવા. બ્લડ ડોનેશન કેમ્પસ, રોગ નિદાન તથા નિવારણ કેમ્પસ તથા યજ્ઞ તથા તબીબી શિબરો યોજવી તથા આવા પ્રોજેક્ટસ તથા આવી પ્રવૃત્તિઓને મદદ કરવી કરાવવી.

(૩) કચ્છ કડવા પાટીદાર સમાજના તથા બહોળા સમાજના અન્ય સમુદાયો માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી જેથી સમાજની એકતા અને અંખડીતતા જળવાઈ રહે અને એક સુદ્રઢ સમાજનું નિર્માણ થાય અને તે માટે જરૂરી એવા તમામ જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્રના હિત માટે તથા લોકોપયોગી જુદીજુદી પ્રવૃત્તિઓ હાથ ધરવી.

(બ) : **અન્ય ઉદ્દેશો તથા હેતુઓ :**

(૧) કોઈપણ જાતના જ્ઞાતિ, જાતી, લિંગ, સમાજ કે રંગના ભેદભાવ વગર માનવમાત્રના આધ્યાત્મિક તથા સાંસ્કૃતીક ઉત્થાન તથા કલ્યાણ થાય અને તેનું જીવન મધુર, દિવ્ય તથા સંસ્કારી બને તે માટે જરૂરી એવી સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, હાથ ધરવી તથા ચલાવવી.

(૨) જાહેર જનતાના લાભાર્થે આધ્યાત્મિક, સાંસ્કૃતીક, શૈક્ષણિક શિબિરો, મેળાવડા, સંમેલનો, વ્યાખ્યાનો, વર્ગો, ચર્ચાઓ, પ્રવૃત્તિઓ કરવી, ચલાવવી તથા આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા કરવી તથા કરાવવી.

(૩) માનવ કલ્યાણ તથા સામાજીક ઉત્કર્ષ માટે આધ્યાત્મિક, સાંસ્કૃતીક, શૈક્ષણિક સાહિત્ય, પુસ્તકો, સામાયીકો, માસીકો, ચોપાનીયા, વિ. પ્રકાશિત કરવા, ચલાવવા અને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન તથા મદદ પૂરી પાડવી તથા પડાવવી.

realpatidar.com

realpatidar.com

(૪) પશુ પંખીઓ, પ્રાણીઓ તથા સર્વ પ્રકારના અબોલા જીવો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, પશુ કેમ્પસ ખોલવા, ઉભા કરવા, ચલાવવા અને આ અંગે જરૂરી એવી સર્વ પ્રકારની પશુ - પક્ષી જીવદયાની પ્રવૃત્તિઓ કરવી તથા ચલાવવી.

(૫) દુષ્કાળ, ધરતીકંપ, પુર, અછત, વાવાઝોડા, રોગચાળા વિ. જેવી કુદરતી આફ્તોમાં તથા માનવસર્જીત અન્ય આફ્તો વખતે કે આકસ્મીક સંજોગોમાં પીડીત સર્વ જીવોને મદદ કરવી કરાવવી. રાહત કેન્દ્ર ખોલવા તથા આવા સંજોગોમાં અન્ન, વસ્ત્ર, દવાઓ, મકાન, આશરા તથા અન્ય સગવડો અને સહાય પૂરી પાડવી તથા પડાવવી અને આવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને મદદ કરવી.

(૬) બહોળા સમાજમાં અને માનવજીવનમાં પ્રચલિત વ્યસનો, બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, માન્યતાઓ વિ. દૂર કરવા અને તે અંગેની પ્રવૃત્તિઓ કરવી.

(૭) દેશના અમુલ્ય સાંસ્કૃતિક, ઐતિહાસીક તથા આધ્યાત્મિક વારસા તથા અન્ય કાર્યક્રમો, પ્રદર્શનો તથા પ્રવૃત્તિઓ કરવી. દેશના અદના નાગરિકમાં દેશ પ્રત્યે દેશદાઝ, દેશપ્રેમ, દેશભાવના તથા માતૃભૂમિ પ્રત્યેની તેમની લાગણી બળવત્તર થાય તે માટેની પ્રવૃત્તિઓ કરવી તથા આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન તથા મદદ પૂરી પાડવી તથા પડાવવી.

(૮) યુવક મંડળો તથા મહિલા ઉત્કર્ષના મંડળો સ્થાપવા તથા ચલાવવા તથા આવી પ્રવૃત્તિઓને વેગ આપવો.

(૯) બહોળા સમાજના હિતમાં અને ખાસ કરીને અશિક્ષિત, બેરોજગાર અને અથવા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સ્વરોજગાર મળી રહે તે હેતુસર અને તેઓ સ્વાવલંબી બને તે પ્રકારની સ્વાશ્રયની પ્રવૃત્તિઓ જેવી કે ગૃહઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ગૃહવપરાશની ચીજ-વસ્તુઓ તથા ખાદ્યપ્રદાર્થની ચીજ વસ્તુઓ,

realpatidar.com

https://archive.org/details/bk919/page/n7/mode/1up

realpatidar.com

પુજા - પ્રસાદની વસ્તુઓ, કુદરતી વનસ્પતિમાંથી બનતી ચીજ-વસ્તુઓ વિ. બનાવવાની સગવડ તથા સવલતો પૂરી પાડવી તથા પડાવવી તથા આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન તથા મદદ પૂરી પાડવી તથા પડાવવી.

(૧૦) ટ્રસ્ટના ઉપરોક્ત મુખ્ય તથા અન્ય ઉદ્દેશોની પૂર્તિ માટે સમાન ઉદ્દેશોવાળી તથા સમાન પ્રવૃત્તિઓ કરતી બીજી અન્ય સંસ્થાઓને/ટ્રસ્ટને સાથ, સહાય, સહકાર તથા સહયોગ પુરા પાડવા તથા લેવા.

(૧૧) ટ્રસ્ટના ઉદ્દેશો પાર પાડવા માટે ભંડોળ પ્રાપ્ત કરવું, નાણાંકીય કે અન્ય સંસ્થાઓ, વ્યકિતઓ પાસેથી વ્યાજ સહીત કે રહીત લોન સ્વરૂપે કે અન્ય રીતે ભંડોળ પ્રાપ્ત કરવું અને આવા ભંડોળ, લોન કે ધીરાણ માટે ટ્રસ્ટની મિલ્કતો ને તારણમાં મૂકવી અને આ અંગે જરૂર હોય તો ટ્રસ્ટે જામીનગીરી આપવી.

૫. **સભ્યપદ :**

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો કોઈપણ વ્યક્તિ કે જે ૧૮ (અઢાર) વર્ષ કે તેથી વધારે ઉંમરની હોય તથા બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હોય તેવી વ્યક્તિ આ અંગે જરૂરી નિયત કરવામાં આવેલ અરજી ફોર્મમાં અરજી કરી તેની સાથે નિયત કરેલ પત્રકો તથા એકરારનામા સંલગ્ન કરી, સભ્ય ફીના રૂા. ૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પૂરા) અથવા વખતોવખત ટ્રસ્ટ મંડળ નક્કી કરે તેટલી રકમ ભરી આ ટ્રસ્ટની આજીવન (કાયમી) સભ્ય બની શકશે.

૬. **સામાન્ય સભા અને તેના કાર્યો :**

અ) સામાન્ય સભા વર્ષ દરમ્યાન એક જ વાર મળશે. પણ જરૂર પડે વધુ વખત પણ બોલાવી શકાશે.

બ) ૨/૩ ભાગના સભ્યોની લેખીત માંગણીથી સભા બોલાવી શકાશે. પણ લેખીત માંગણીની અરજીમાં સભા બોલવવાના કારણો જણાવવાના રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk919/page/n8/mode/1up

realpatidar.com

ક) સામાન્ય સભાના બધા જ કામો બહુમતીથી કરવામાં આવશે.

ડ) સામાન્ય સભાની જાણ સભ્યોને સાત દિવસ અગાઉથી કરવામાં આવશે.

ઈ) સામાન્ય સભા મળી શકે તેમ ના હોય તેવા સંજોગોમાં સભ્યોને પરીપત્ર દ્વારા જાણ કરી સભ્યોની સંમતી મેળવીને વધુ મતે નિર્ણય કરવામાં આવશે.

૭. **ટ્રસ્ટના ટ્રસ્ટીઓ :**

અ) આ ટ્રસ્ટમાં ઓછામાં ઓછા ૭ અને વધુમાં વધુ ૫૧ ટ્રસ્ટીઓ રાખી શકાશે.

ટ્રસ્ટીઓની નિમણુંક, તેમને ચાલુ રાખવા, છુટા કરવાનો અધિકાર ટ્રસ્ટી મંડળને રહેશે.

સદર ટ્રસ્ટના સંસ્થાપન વખતે અને પછીથી અન્ય ફેરફાર ન થાય ત્યાં સુધી બિનસાંપ્રદાયીક વિચારધારા ધરાવતા કચ્છ કડવા પાટીદાર સમાજની નીચેની વ્યક્તિઓ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓ તરીકે રહેશે.

૧.	શ્રી રામજીભાઈ કરમશીભાઈ પટેલ	પ્રમુખ
૨.	શ્રી દામુભાઈ દેવશીભાઈ પટેલ	ઉપપ્રમુખ
૩.	શ્રી અબજીભાઈ કરમશીભાઈ પટેલ	ઉપપ્રમુખશ્રી
૪.	કરશનદાસ પચાણભાઈ પટેલ	મહામંત્રી
૫.	શ્રી શિવલાલ નાનજીભાઈ પટેલ	મંત્રી
૬.	શ્રી ભાઈલાલભાઈ કાનજીભાઈ પટેલ	મંત્રી
૭.	શ્રી હરિભાઈ પરબતભાઈ પટેલ	ખજાનચી

સદર ટ્રસ્ટની નોંધણી થયા પછી છ માસમાં ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટના બીજા ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવશે.

બ) **ટ્રસ્ટીઓની મુદત :**

સદર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મુદર ૩ વર્ષની રહેશે. આવી મુદત પૂરી થયે નવા ટ્રસ્ટીઓની નિમણુંક ન થાય ત્યાં સુધી ચાલુ ટ્રસ્ટીઓ ચાલુ રહેશે, પરંતુ કોઈપણ સમયે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સંખ્યા સાત કરતાં ઓછી રહેશે નહિં.

realpatidar.com

realpatidar.com

ક) **અનુગામી ટ્રસ્ટીઓ નિમવાની રીત :**

અનુગામી ટ્રસ્ટીઓ નિમવાની રીત નીચે મુજબ રહેશે.

ઉપરોક્ત ટ્રસ્ટીઓ કે તે પછી નિમણુંક થયેલ ટ્રસ્ટીઓની મુદત પૂરી થત કે તેમના મૃત્યુથી કે તેમના રાજીનામાંથી કે તેમના ટ્રસ્ટી તરીકે રહેવા અશિક્તમાન બનાવના સંજોગોમાં કે અન્ય રીતે ટ્રસ્ટીની જગ્યા ખાલી પડતાં ટ્રસ્ટી મંડળ અન્ય વ્યક્તિ કે વ્યકિતઓને ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે લઇ શકશે. પરંતુ આવી અન્ય વ્યકિત કે વ્યકિતઓ કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી બિનસાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હોવી જોઈએ.

ડ) **ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો :**

ટ્રસ્ટના સરળ તથા સુગમ વહીવટ તથા સંચાલન માટે ટ્રસ્ટી મંડળનાસભ્યો તેમના પૈકી ટ્રસ્ટના નીચે મુજબના હોદ્દેદારોની નિમણુંક કરી શકશે અને કાર્યક્ષમ, પારદર્શક વહીવટ થાય તે માટે તેમના કાર્યો અને ફરજો નક્કી કરી શકશે.

અ) પ્રમુખ બ) ઉપપ્રમુખ-૨ ક) મહામંત્રી ડ) મંત્રીઓ-૨ અને ઈ) ખજાનચી

ઉપરોક્ત હોદ્દેદારો પૈકી કોઈની કોઈપણ કારણોસર જગ્યા ખાલી પડવાના સંજોગોમાં આવી ખાલી પડેલ જગ્યા પર નવી નિમણુંક ટ્રસ્ટી મંડળ તેઓ પૈકી કોઈની નિમણુંક કરી શકશે.

ઈ) **ટ્રસ્ટીઓની ફરજો અને કાર્યો :**

સદર ટ્રસ્ટની સ્થાવર મિલ્કતો તથા જંગમ મિલ્કતો ટ્રસ્ટના અને / અથવા ટ્રસ્ટીઓના નામ ઉપર રાખવામાં આવશે. ટ્રસ્ટનો તમામ વહીવટ તથા સંચાલન ટ્રસ્ટી મંડળ કરશે. ટ્રસ્ટીઓ નીચેની ફરજો અને કાર્યો કરશે.

૧. ટ્રસ્ટની સ્થાવર તથા જંગમ મિલ્કતો ખરીદવી, વસાવવી તથા તેનો વહીવટ ટ્રસ્ટના મૂળભૂત ધ્યેયને અનુસરીને કરશે અને આ અંગે ઉદ્ભવતા તમામ કાર્યો તથા પ્રવૃત્તિઓ કરશે.

realpatidar.com

realpatidar.com

૨. ટ્રસ્ટના વહીવટ તથા કામ માટે અને / અથવા ટ્રસ્ટની મિલ્કતની સંભાળ રાખવા માટે રાખેલ કાર્યકરો તથા વહીવટ માટેના નિયમો અને ધારાધોરણો ટ્રસ્ટના મૂળભૂત ધ્યેયને અનુસરીને ઘડશે તથા તેનો અમલ કરાવશે.

૩. ટ્રસ્ટના હેતુઓ પૂરા કરવા તથા આગળ ધપાવવા માટેની પ્રવૃત્તિઓ કરવી અને અમલમાં મૂકવી અને અન્ય સંસ્થાઓ તરફથી સદર ટ્રસ્ટના ઉદ્દેશો સમાન થતી પ્રવૃત્તિઓને સાથ, સહકાર, સહાય તથા સગવડ પૂરી પાડવી.

૪. કાર્યકરોની નિમણુંક, બદલી, ફેરફાર, બરતરફી વિ. કરવા તથા તેના નિયમન માટેના તમામ પગલાં ભરવા.

૫. ટ્રસ્ટના હેતુઓને અનુરૂપ દાન, ભેટ, બક્ષિસ, ફંડ વિ. સ્વીકારવા તથા તેનો વહીવટ કરવો અને તેનું રોકાણ કરવું.

૬. ટ્રસ્ટની જુદીજુદી પ્રવૃત્તિઓ માટે જરૂર પડ્યે પેટા સમિતિઓ રચવી અને તેના નિયમન-સંચાલન માટેના ધારા-ધોરણો નિતી-નિયમો ઘડવા અને તેમની સત્તા તથા જવાબદારીઓ નક્કી કરવી.

૭. ટ્રસ્ટના હિસાબો વ્યવસ્થિત રાખવા અને તેના તપાસાર્થે અન્વેષક (ઓડીટર) ની નિમણુંક કરવી અને તેમનું મહેનતાણું નક્કી કરવું.

૮. ટ્રસ્ટના તથા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત અન્ય સંસ્થા કે સંસ્થાઓના વહિવટ તથા કાર્યો ટ્રસ્ટી મંડળ તેની દેખરેખ હેઠલ કાર્યવાહક સમિતિ રચવી તથા તેમની સત્તા, અધિકારો તથા જવાબદારી નક્કી કરવી. તદ્ઉપરાંત ટ્રસ્ટના વહીવટ તથા સંચાલન માટે સલાહકાર મંડળની રચના કરવી તથા ટ્રસ્ટના વહીવટ તથા સંચાલન માટે જરૂરી તજજ્ઞોની નિમણુંક કરવી.

૯. વિવિધ હેતુઓ માટે રચવામાં આવેલ કારોબારી સમિતિઓ તથા અન્ય સમિતિઓની રચના અને કાર્યપ્રણાલી બાબતે ટ્રસ્ટી મંડળ નિતિ-નિયમો બહાર પાડશે. જે નિતિ-નિયમો પ્રમાણે આવી સમિતિઓએ કામ કરવાનુંરહશે.

૧૦. ટ્રસ્ટીઓ આ ટ્રસ્ટના વિવિધ હેતુઓ તથા ઉદ્દેશો પાર પાડવા માટે યુવા મંડળની રચના કરી શકશે. આવા મંડળોની રચના અને કાર્યપ્રણાલી બાબતે ટ્રસ્ટી મંડળ નિતી-નિયમો બહાર પાડે તે નિતી - નિયમો પ્રમાણે આવા મંડળોએ કામ કરવાનું રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk919/page/n11/mode/1up

realpatidar.com

૧૧. ટ્રસ્ટના ઉદ્દેશો વિરૂદ્ધ વર્તન કે કાર્ય કરનાર અથવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં કોઈપણ પ્રકારની સેવા ન આપનાર એવા કોઈપણ ટ્રસ્ટીને ટ્રસ્ટના ટ્રસ્ટી પદેથી દૂર કરી શકશે.

૧૨. ટ્રસ્ટ તથા ટ્રસ્ટ સંચાંલિત અન્ય સંસ્થાઓના સમયાંતરે નિરીક્ષણ તથા પરિક્ષણ અંગેની જોગવાઈ કરવી.

૧૩. ટ્રસ્ટના હેતુઓ તથા ઉદ્દેશો અસરકારક રીતે પૂરા કરવા તથા ટ્રસ્ટની મિલ્કતો અને ભંડોળના સુચારૂ ઉપયોગ માટે જરૂરી એવા તમામ આનુષાંગિક કામો તથા કાર્યો કરવા.

૧૪. ટ્રસ્ટ તથા તે સંચાલીત અન્ય સંસ્થાઓના વહીવટ, નિભાવ, વિકાસ અને પ્રવૃત્તિઓ માટે સ્થાવર તથા જંગમ મિલ્કતો ખરીદવી, વસાવવી, ભાડા ઉપર કે લીઝથી મેળવવી, ભેટ, બક્ષિસ કે દાન સ્વરૂપે મેળવવી. નવી મિલ્કતો ખરીદવા કે વસાવવા આવી નવી મિલ્કતો કે ટ્રસ્ટની પોતાની માલિકીની હયાત મિલ્કતોને તારણમાં મૂકી બેન્ક, નાણાંકીય સંસ્થા, ટ્રસ્ટ, શરાફ, પેઢી, કંપની, સરકાર અગર કોઈપણ વ્યક્તિ કે વ્યકિતઓ કે સંસ્થાઓ પાસેથી લોન કે અન્ય સ્વરૂપે ધિરાણ કે નાણાં ઉછીના લેવા તથા આ અંગે જરૂરી હોય તો ટ્રસ્ટની જામીનગીરી આપવી. મિલ્કતો તારણમાં મૂકવી અને આ અંગેનો વ્યાજ સહિતનો તમામ ખંર્ચ ટ્રસ્ટનો જ ગણાશે.

૧૫. ટ્રસ્ટ વતી સરકારી, અર્ધ-સરકારી ઓફીસોમાં કે યુનિવર્સીટીઓમાં શિક્ષણ બોર્ડ કે મંડળમાં, મ્યુનિસિપાલીટી કે અન્ય જાહેર સત્તા મંડળોમાં કે ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓની ઓફીસોમાં રજુઆત કરી શકશે.

૧૬. ટ્રસ્ટની કોઈપણ સંસ્થાઓમાં સરકારી ધારાધોરણ મુજબ ફી કે આવક ના ધોરણો નક્કી કરવા.

૧૭. ટ્રસ્ટના વહીવટ કે સંચાલન કે અધિકારો કે સત્તાને લગતી આ ટ્રસ્ટ ડીડ/ બંધારણમાં કોઈ સ્પષ્ટ કે અન્ય કોઈ રીતે જોગવાઈ ન હોય તેવી તમામ બાબતો અને / અથવા ભવિષ્યમાં ઉભી થનાર કોઈ બાબત કે પરિસ્થિતિ અંગે નિર્ણય લઈ આ અંગેના નિયમો ઘડી શકશે.

realpatidar.com

realpatidar.com

૧૮. ટ્રસ્ટી મંડળ કે તેના કોઈપણ સભ્યો ટ્રસ્ટ કે ટ્રસ્ટ સંચાલીત અન્ય સંસ્થાઓ પાસેથી કોઈપણ પ્રકારનું મહેનતાણું મેળવી શકશે નહિં.

ફ) ટ્રસ્ટીઓની મિટિંગ :

ટ્રસ્ટીઓની મિટીંગ એક વર્ષમાં ઓછામાં ઓછી ૪ વખત મળશે. આ ઉપરાંત વધારાની મિટીંગની જરૂર પડયે ત્યારે આવી મિટિંગ બોલાવી શકાશે. મિટિંગમાં નિર્ણયો સર્વાનુમતે અથવા બહુમતિથી કરવાના રહેશે. ટ્રસ્ટી મંડળની મિટિંગનું કોરમ ઓછામાં ઓછું ૫ (પાંચ) અથવા ટ્રસ્ટી મંડળની કુલ સંખ્યાના ૧/૩ સભ્યો, આ બે માંથી જે વધારે હશે તેટલું રહેશે. રોજબરોજના કામને લગતી સામાન્ય વિગતો અને /અથવા તાત્કાલીક જરૂરીઆતવાળા કામ અંગેના નિર્ણય ટ્રસ્ટી મંડળની મિટીંગ બોલાવ્યા વગર ફક્ત પરિપત્રથી મિટીંગ કરી આવું કામ કરી શકશે.

ટ્રસ્ટી મંડળની મિટિંગમાં કોઈપણ કામ કે નિર્ણય તેમાં હાજર સભ્યોની બહુમતિથી કરી શકાશે. સરખા મત પડે ત્યારે જે તે સભાના અધ્યક્ષને ટ્રસ્ટના સભ્ય તરીકે તથા સભાના અધ્યક્ષ તરીકે એક વધારાનો કાસ્ટીંગ મતનો અધિકાર રહેશે.

૮. પેટા સમિતિઓ / કમિટિઓ :

ટ્રસ્ટના વિવિધ કાર્યો તથા હેતુઓ પાર પાડવા માટે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સારૂં ટ્રસ્ટી મંડળ એક કે એક કરતાં વધુ કામ માટે એક કે એક કરતાં વધુ સમિતિઓની રચના કરશે. આવી સમિતિઓના સભ્યો ટ્રસ્ટના આજીવન સભ્યોમાંથી નિમવાના રહેશે. આવી સમિતિઓ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના વડપણ, આદેશ, અંકુશ તથા દેખરેખ હેઠળ કામ કરશે. અને આવી સમિતિઓ ટ્રસ્ટી મંડળને જવાબદાર રહેશે. આવી સમિતિઓએ તેમને સોંપવામાં આવેલ કામગીરી ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે આપેલ નિતિ-નિયમો, સુચના, આદેશ તથા માર્ગ દર્શક નિયમો પ્રમાણે કરવાનીરહેશે.

realpatidar.com

realpatidar.com

૯. **હિસાબો રાખવા બાબત :**

ટ્રસ્ટની મિલ્કતની વ્યવસ્થા તથા પ્રવૃત્તિઓ સંબંધી યોગ્ય અને સાચો હિસાબ રાખવાની જવાબદારી અને તે હિસાબોને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ ઓડીટ કરાવી ઉપરી સત્તાધીશની કચેરીએ ફાઈલ કરાવવાની જવાબદારી ટ્રસ્ટી મંડળની રહેશે.

ટ્રસ્ટના હિસાબોનું વર્ષ ૧ લી એપ્રિલ થી શરૂ કરી ૩૧ મી માર્ચ સુધીનું રહેશે.

૧૦. **ટ્રસ્ટની મિલ્કત તથા નાણાં બાબત :**

ટ્રસ્ટના મિલ્કત તથા નાણાં ધી બોમ્બે પબ્લિક એક્ટ, ૧૯૫૦ની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને અનુરૂપ રોકવાનાં રહેશે. ટ્રસ્ટના રોજબરોજના કામ તથા વહિવટ માટેના જરૂરી નાણાં ટ્રસ્ટી પાસે હાથ ઉપર રાખી શકાશે.

ટ્રસ્ટની મિલ્કતો તથા ભંડોળ સંયુક્ત રીતે ટ્રસ્ટની માલિકીના જ રહેશે. તેના પર કોઈ વ્યક્તિ કે સંસ્થાનો હક્ક કે અધિકાર રહેશે નહિં.

૧૧. **ટ્રસ્ટના બેન્ક ખાતા બાબત :**

ટ્રસ્ટના નાણાં તથા મિલ્કતના સરળ વહીવટ માટે ટ્રસ્ટના નામે બેંકમાં કોઈપણ પ્રકારનું ખાતું કે ખાતા ખોલાવી શકાશે અને આવા ખાતાઓમાં લેવડ-દેવડ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળમાં નક્કી કર્યા મુજબના કોઈપણ બે ટ્રસ્ટીઓની સંયુક્ત સહીથી કરી શકાશે.

realpatidar.com

https://archive.org/details/bk919/page/n14/mode/1up

realpatidar.com

૧૨. ટ્રસ્ટના આવક અને ખર્ચ બાબત :

ટ્રસ્ટ તેની પ્રવૃત્તિઓ ચલાવવા તેના માટે જરૂરી નાણાંકીય ફંડ તથા ભંડોળ માટે દાન, બક્ષિસ, ભેટ, સહાય, સહયોગ, મદદ વિ. સ્વીકારી શકશે તથા ટ્રસ્ટના ફાજલ ફંડ / ભંડોળમાંથી નાણાં રોકી તેમાંથી વ્યાજ, ડિવિડન્ડ વિ. ની આવાક મેળવી શકશે. તદ્ઉપરાંત ટ્રસ્ટની મિલ્કતને ભાડે આપી કે અન્ય રીતે ઉપયોગ કરી કે કરાવી તેમાંથી આવક મેળવી શકશે. ટ્રસ્ટ શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય કાર્યક્રમો યોજી તેમાંથી આવક ઉભી કરી શકશે. આ ઉપરાંત સરકાર, સરકારી, અર્ધ-સરકારી અને /અથવા અન્ય સંસ્થાઓ પાસેથી ગ્રાન્ટ, સબસીડી, સહાય વિ. માંથી મેળવી શકશે. ટ્રસ્ટી મંડળને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ચલાવવા માટે જરૂરી તથા વ્યાજબી ખર્ચ કરવાની સત્તા રહેશે.

૧૩. અન્ય :

(૧) ટ્રસ્ટના નિયમોનુસારના નિયત સત્તા મંડળની મંજુરી વગર કોઈપણ વ્યક્તિગત સભ્યે કરેલ નિર્ણય કે કામ માન્ય ગણાશે નહિં અને આવા કામ કે કાર્ય માટે ટ્રસ્ટ કોઈપણ સંજોગોમાં જવાબદાર રહેશે નહિં.

(૨) ટ્રસ્ટના કોઈપણ સભ્યને ટ્રસ્ટ કે તે દ્વારા સંચાલિત સંસ્થા સંબંધિત કોઈપણ બાબતે ટ્રસ્ટ કે ટ્રસ્ટના કોઈપણ અન્ય સભ્ય સાથે મતભેદ પડે કે ટ્રસ્ટમાં કે તેના સંચાલનમાં કોઈ વિવાદ કે ઝઘડો ઉભો થાય કે થવાના સંજોગોમાં તેના નિકાલ કે નિરાકરણ માટે કોઈપણ કોર્ટ કે કચેરીનો આશરો લેવાના બદલે પરસ્પર સમજુતિથી અને / અથવા લવાદ કે લવાદો દ્વારા આવા મતભેદ કે વિવાદનો ઉકેલ મેળવવાનો રહેશે. આવા લવાદ કે લવાદો દ્વારા અપાયેલ નિર્ણય સર્વને માન્ય ગણવાનો રહેશે.

(૩) ટ્રસ્ટને, એવી જરૂરીયાત કે સંજોગો ઉભા થાય બંધ કરવાની સ્થિતી ઉભી થાય તો તેવા સંજોગોમાં ટ્રસ્ટના ભંડોળ અને મિલ્કતની વ્યવસ્થા તથા નિકાલ ટ્રસ્ટને લાગુ પડતા કાયદાનીજોગવાઈઓ અનુસાર કરી ટ્રસ્ટ બંધ કરી શકાશે. આ માટે ટ્રસ્ટ પોતાની મિલ્કત અને ભંડોળ તેના જેવા જ હેતુઓ ધરાવતા કે તેના જેવી જ પ્રવૃતિઓ કરતા ટ્રસ્ટ કે સંસ્થાને આપી શકશે.

(૪) ટ્રસ્ટ તેના વહીવટ તથા વિકાસ માટે કોઈપણ પ્રકારની સ્થાવરકે જંગમ મિલ્કત વસાવી શકશે.

realpatidar.com

realpatidar.com

(૫) ટ્રસ્ટીઓને યોગ્ય લાગે તો ટ્રસ્ટના હિતમાં સમાજના પ્રતિષ્ઠિત અને સંસ્કારી વ્યક્તિ કે વ્યકિતઓને ટ્રસ્ટના વહીવટ અને સંચાલનમાં મદદરૂપ થવા માર્ગદર્શક/સલાહકાર કે ટ્રસ્ટી મંડળમાં લઈ તેમની સેવાઓ લઈ શકશે.

(૬) ટ્રસ્ટના નાણાં તથા મિલ્કતનો ઉપયોગ ટ્રસ્ટના હેતુઓ માટે કે આવા હેતુઓ વાળા અન્ય ટ્રસ્ટ કે સંસ્થાને આપી શકાશે.

(૭) આ ટ્રસ્ટ ડીડ/બંધારણમાં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી તે બાબતો માટે બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની જોગવાઈઓ લાગુ પડશે.

(૮) સદર ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ/બંધારણમાં કે તેની કોઈપણ કલમમાં ફેરફાર કરવો હશે તો ટ્રસ્ટી મંડળની મિટિંગમાં ૨/૩ બહુમતિથી ઠરાવ કરી આવો ફેરફાર કરી શકાશે.

સદર ટ્રસ્ટની રચના તથા સંસ્થાપનના સદર બંધારણની સાક્ષીરૂપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આજરોજ તારીખ ૨૯ મી માર્ચ, ૨૦૧૦ ના અમદાવાદ મુકામે આ ટ્રસ્ટ ડીડ/ બંધારણ ઉપર નીચેના સાક્ષીઓની રૂબરૂમાં સહીઓ કરેલ છે.

ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

૧. શ્રી રામજીભાઈ કરમશીભાઈ પટેલ

૨. શ્રી દામુભાઈ દેવશીભાઈ પટેલ

૩. શ્રી અબજીભાઈ કરમશીભાઈ પટેલ

૪. શ્રી કરશનદાસ પચાણભાઈ પટેલ

૫. શ્રી શિવલાલ નાનજીભાઈ પટેલ

૬. શ્રી ભાઈલાલભાઈ કાનજીભાઈ પટેલ

૭. શ્રી હરિભાઈ પરબતભાઈ પટેલ

realpatidar.com

https://archive.org/details/bk919/page/n16/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk919/page/n17/mode/1up

realpatidar.com

બુક-પોસ્ટ

શ્રીમાન / શ્રીમતી,

રવાના :

સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન

"દયા સાગર", ૧૦, અમૃત પાર્ક સોસાયટી, પાલડી,

અમદાવાદ-૩૮૦ ૦૦૭.

realpatidar.com